

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૨/૦૬/૨૦૧૬ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:- સમાચાર યાદી નં.૧૦૨૨/૧૬

દેશી બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝબ્બે કરતી એસ.ઓ.જી. અમદાવાદ શહેર

સંયુક્ત પોલીસ કમિશનર શ્રી જે.કે.ભટ્ટ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટીપન ભદ્રન સાહેબ કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી.સી.સોલંકી સાહેબ એસ.ઓ.જી. કાઇમ અમદાવાદ શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.ડી.જાડેજા એસ.ઓ.જી. કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર નાઓએ શહેરમાં ગેરકાયદેસર હથિયારના ગુનાઓ શોધી કાઢવા તેમજ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા સુચના કરેલ. જે સુચના આધારે પોસઇ શ્રી એ.કે.વડીયા તથા પોસઇ શ્રી પી.બી.દેસાઇ તથા પોસઇ શ્રી એન.એન.રબારી નાઓ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ફરતા ફરતા સાબરમતી કેશવનગર જે.પી.ની ચાલીના નાકે આવતાં સાથેના હેડ.કોન્સ મયુરધ્વજસિંહ રાજેન્દ્રસિંહ તથા પો.કો ગિરવતસિંહ જેઠુસિંહ નાઓએ સંયુક્ત બાતમી હકીકત આપેલ જે બાતમી હકીકત આધારે વોચ કરતા સાબરમતી કેશવનગર જે.પી.ની ચાલીની આગળ રોડ ઉપરથી આરોપી તરુણ ખોડીદાસ પરમાર ઉવ.૨૯ ધંધો: મજૂરી રહે, ભરતભાઇ રબારીના મકાનમાં, રબારી વાસ, અચેર, સાબરમતી, અમદાવાદ શહેર નો મળી આવેલ. જેની અંગઝડતી માંથી દેશી બનાવટનો તમંચો મળી આવેલ. જેથી સદરહું આરોપીને અટક કરી તેના વિરુદ્ધમાં હથિયારધારા મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ છે અને આ સિવાય બીજા કોઇ હથિયાર બાબતે આરોપીની સઘન પુછપરછ ચાલું છે. તા.૦૨/૦૬/૨૦૧૬

ઘોળકા રૂરલ પો.સ્ટેશનના કેટલા સમયથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી સાઇબર સેલ
કાઇમ બ્રાંચ અમદાવાદ શહેર

સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી કાઇમ બ્રાંચ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી કાઇમ બ્રાંચ તથા મ.પો.કમિ.શ્રી સાયબર કાઇમ સેલ, તથા પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર.સરવૈયા સાઇબર કાઇમ બ્રાંચ નાઓની સુચનાથી પો.સ.ઇ.શ્રી વી.કે.ખાંટ તથા પો.સ.ઇ.શ્રી જે.પી.રોજીયા નાઓ તથા સ્ટાફના માણસો સાથે નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા સારુ તા-૦૧/૦૬/૨૦૧૬ ના રોજ પેટ્રોલીંગમાં ફરતા હતા દરમ્યાન સૈજપુર આર્યસમાજ રોડ આગળ એક ઇસમ નામે કૌશલકિશોર ઉર્ફે વીક્કી જયનારાયણ દોહરે આરોપીને ચાલતો ચાલતો સૈજપુર આર્યસમાજ રોડથી આવતો હતો તેવામાં સાથેના પો.કો.બાબુભાઇ વિરસંગભાઇનાઓને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે કૌશલકિશોર ઉર્ફે વીક્કી જયનારાયણ દોહરે ઉ.વ.૨૨ ધંધો. ડ્રાયવીંગ રહેવાસી.મારવાડીની ચાલી ગુરુદ્વારા પાસેગુરુકૃપાનગર ભાર્ગવરોડ મેઘાણીનગર અમદાવાદ શહેર નાનો સદરી ઘોળકા રૂરલ પો.સ્ટે.ના ફ,ગુ,ર,નં,ફ.૨૮/૧૬ ઇ.પી.કો.૩૭૯ વિગેરે મુજબના ગુનામાં વોન્ટેડ હોય જેથી સદરીને આજરોજ તા.૦૧/૦૬/૨૦૧૬ ના કલાક;-૧૮/૦૦ વાગે ભાર્ગવ ચાર થી પકડી ઘોળકા રૂરલ પો.સ્ટે.ના ગુનામાં વોન્ટેડ હોઇ જેથી આગળ ની યોગ્ય કાર્યવાહી કરવા ઘોળકા રૂરલ પો.સ્ટે સોપવા તજવીજ કરેલ છે.

નાયબ પોલીસ કમિશ્નર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશ્નર વતી.